



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૬/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૩૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૫ કેસ કરી, ૨૭ વ્યક્તિઓને ઝડપી, ૨૬૬ લીટર દેશી દારૂ, ૨૧૮ બોટલ ઈંગ્લીશ દારૂ ૦૧ મોટર સાયકલ, ૦૧ સ્ફૂટર અને ૦૧ રીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૬ કેસ કરી ૧૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૨,૭૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૩૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૦૩૯/૧૯

શહેરકોટડા : મોહમદઅબ્બાસ મોહમદયાસીન શેખ (રહે,હીરાલાલ કનૈયાલાલની ચાલી આઇ.ટી.આઇ ની બાજુમા સરસપુર) એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૦૬/૧૯ ના કલાક ૦૦/૩૦ થી ૪/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના ધાબા ઉપરથી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, રોકડ રૂપિયા ૨૫.૦૦૦/-, સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૫ કુલ કિંમત રૂપિયા ૩૫.૦૦૦/- તથા પડોશી ઇમામહુસૈન લાલમોહમદ શેખ નો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૩,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૦૩,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ડી.ચાવડા ચલાવે છે.

કૃષ્ણનગર : ધનરાજભાઇ ફાગુનમલ સેજાણી (ઉ.વ.૫૩)(રહે.પ્રેમનગર સોસાયટી સૈજપુર નવી ચાલી મોદી કંમ્પાઉન્ડ ની સામે સૈજપુર બોધા કૃષ્ણનગર) એ તા.૧૭/૬/૧૯ નારોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૫/૧૯ રાતના ૧૦/૧૫ થી તા.૩૦/૫/૧૯ ના કલાક ૦૦/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના દરવાજાને ધક્કો મારી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૪,૮૧,૯૭૩/- તથા રોકડ રૂપિયા ૫૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫,૩૫,૯૭૩/- મતાની ચોરી કરી લઇ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી વી.આર.ચૌધરી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૦૪૦/૧૯

સરખેજ : અવધેશ ઓમવીરસિંગ બાલીયાન (ઉ.વ.૩૬)(રહે.સર્જન એપાર્ટમેન્ટ સત્યમ મોલની પાછળ ચાંગોદર તા.બાવળા જી.અમદાવાદ)એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૦૬/૨૦૧૯ ના કલાક ૧/૪૫ થી ૩/૩૦ સુધીના સમયગાળા દરમ્યાન બાકરોલ ચોકડી પાસે આવેલ પોતાના “બાલાજી નંદન ઇસ્ટર પ્રાઈઝીસ પ્રા.લી.” ના ખુલ્લા ગોડાઉનમાંથી ટ્રેકટરોની એક્સાઈડ અને એમરોન કંપનીની કુલ-૩૪ બેટરીઓ કુલ રૂપિયા ૧,૮૭૦૦૦/- મતાની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.સી.પરમાર ચલાવે છે.

વાહનચોરી :-

સમાચાર યાદી નં.૧૦૪૧/૧૯

એલીસબ્રીજ : રાજન ભાઈલાલભાઈ પટેલ (રહે.અલ્કાપુરી સોસાયટી ઘાટલોડીયા) એ તા.૧૭/૦૬/૨૦૧૯ નારોજ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૪/૦૬/૨૦૧૯ ના કલાક ૯/૦૦ થી સાંજના ૫/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન વી.એસ.હોસ્પિટલમા આવેલ ફીઝીયોથેરાપી કોલેજની સામે પોતાની હ્યુન્ડાઇ કંપનીની સેન્ટ્રો ગાડી નંબર જીજી.૦૧.કે.બી.૫૪૫૪ કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- મતાની પાર્ક કરી મુકી હતી. જેની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જી.ખાંભલા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૪૨/૧૯

શહેરકોટડા : અશોકભાઈ રાંજુમલ જયસ્વાની (ઉ.વ.૪૫)(રહે.આર.એલીગન્સ, સરદારનગર, બર્હાકુમારી આશ્રમ પાસે) અગમ્ય કારણસર તા.૧૭/૦૬/૨૦૧૯ રાતના ૯/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે નરોડા રોડ અશોક મિલ સામે આવેલ “દીપ એજન્સી” નામની દુકાનના ઉપરના માળે છતના ભાગે લગાડેલ હુકમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી ઇશ્વરભાઈ સોમાભાઈ ચલાવે છે.

અમરાઈવાડી : હિમ્મતસિંહ જસવંતસિંહ ચૌહાણ (રહે.શિવશક્તિ ફ્લેટ સત્યમનગર શાકમાર્કેટ પાસે અમરાઈવાડી) એ અગમ્ય કારણસર તા.૧૭/૦૬/૨૦૧૯ ના કલાક ૭/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે સીલીંગ ફેન સાથે દુપટ્ટે બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રમેશચંદ્ર સામંતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.